

# गुनासो सम्बोधन तथा सुभाव व्यवस्थापन कार्यविधि २०८१

कार्यपालिकाबाट स्वीकृत मिति : २०८१/१०/२९ गते



विजयनगर गाउँपालिका,  
गाउँकार्यपालिकाको कार्यालय खुरुहुरिया, कपिलवस्तु  
लुम्बिनी प्रदेश, नेपाल





## ગુનાસો સમ્બોધન તથા સુભાવ વ્યવસ્થાપન કાર્યવિધિ ૨૦૮૧

### **પ્રસ્તાવના**

નેપાલકો સંવિધાન ૨૦૭૨ કો ધારા ૫૧ ખ (૪) લે સાર્વજનિક પ્રશાસનલાઈ સ્વચ્છ, સક્ષમ, નિષ્પક્ષ, પારદર્શી, ભ્રષ્ટાચારમુક્ત, જનઉત્તરદાયી ર સહભાગિતામૂલક બનાઉંડૈ રાજ્યવાટ પ્રાપ્ત હુને સેવા સુવિધામા જનતાકો સમાન, સહજ પહુંચ સુનિશ્ચિત ગરી સુશાસનકો પ્રત્યાભૂતિ ગર્ને પ્રાવધાન વર્મોજિમ સંઘ, પ્રદેશ ર સ્થાનીય તહ એવં સો અન્તરગતકા કાર્યાલય, સંઘ સંસ્થાહરુવાટ સ્થાનીય તહમા પ્રવાહિત સેવા, સંચાલિત વિવિધ કાર્યક્રમ એવં ભૌતિક તથા સામાજિક પૂર્વાધાર ર યસ સંગ સમ્વન્ધિત ગુણસ્તર, પ્રભાવકારિતા તથા હુનસકને અનિયમિતતા સમ્વન્ધ્યમા જનતાકો અસન્તુષ્ટિ, સિકાયત, ઉજુરી એવં ગુનાસો સુન્ન તથા ત્યસકો વ્યવસ્થાપન એવમ સંબોધન ગર્ન, સાર્વજનિક સંસ્થા, સેવા એવં કાર્યક્રમમા નાગરિકો પહુંચ, સંલગ્નતા તથા સહભાગિતા વૃદ્ધિ ગરી નિયમિત રૂપમા સુભાવ એવં પૃષ્ઠપોષણ લિનું સ્થાનીય પાલિકાહરુકો દાયિત્વ હો ભર્નિ સ્પષ્ટરૂપમા વ્યાખ્યા ગરેકો છે । સ્થાનીય સ્તરમા સુશાસનકો પ્રત્યાભૂતિકો લાગિ સુશાસન પ્રબર્દ્ધન રણનીતિ તથા કાર્યયોજના, ૨૦૭૪ લે નિર્દેશિત ગરેઅનુસાર સુભાવ તથા ગુનાસો વ્યવસ્થાપન તથા સમ્બોધન ગર્ન આવશ્યક હુન્છ ।

ગુનાસો વ્યવસ્થાપન તથા સમ્બોધનલાઈ પ્રભાવકારી બનાઉન સુશાસન પ્રબર્દ્ધન રણનીતિ તથા કાર્યયોજના, ૨૦૭૪ લે નિર્દેશિત ગરે અનુસાર પાલિકાલે છુટ્ટે ગુનાસો સુનુવાઈ તથા વ્યવસ્થાપન કાર્યવિધિ તયાર ગરી કાર્યાન્વયન ગર્ન સક્દછ ર સોહિ અનુસાર સુભાવ તથા ગુનાસો વ્યવસ્થાપન તથા સમ્બોધન ગર્નુ પર્દછ । પાલિકાસંગ છુટ્ટે ગુનાસો સુનુવાઈ કાર્યવિધિ નભએકો ખણ્ડમા દેહાય વર્મોજિમ ગુનાસો વ્યવસ્થાપન તથા સમ્બોધન ગર્ન સકિન્છ ।

### **પરિચ્છેદ-૧ પ્રારમ્ભિક**

#### **૧.૧. સંક્ષિપ્ત નામ ર પ્રારમ્ભ :**


- (ક) યો કાર્યવિધિકો નામ “ગુનાસો સમ્બોધન તથા વ્યવસ્થાપન કાર્યવિધિ, ૨૦૮૧” રહને છે ।
- (ખ) યો કાર્યવિધિ કાર્યપાલિકાવાટ સ્વીકૃત ભએકો મિતિ દેખિ પ્રારમ્ભ હુનેછ ।

#### **૧.૨. કાર્યવિધિકો ઉદ્દેશ્ય :**

- સ્થાનીય તહ ભિત્રકા વડા કાર્યાલય, વિષયગત શાખા તથા ગાઉંપાલિકા ભિત્ર કાર્યરત વિભિન્ન સંઘ, સંસ્થા ર કાર્યક્રમકો સેવા સુવિધામા નાગરિકો પહુંચ, સહભાગિતા વૃદ્ધિ ગરી સુશાસનકો પ્રત્યાભૂતિ દિલાઉને ,
- ગાઉંપાલિકા ભિત્ર સંચાલિત આયોજના/કાર્યક્રમહરુ બારે નાગરિકકા જિજાસાહરુલાઈ સમ્બોધન ગર્દે સ્થાનીય તહકો પારદર્શિતા કાયમ ગર્ને,
- અસન્તુષ્ટિ, સિકાયત વા ઉજુરી તથા ગુનાસો સુનુવાઈ, સમ્બોધન તથા વ્યવસ્થાપનકો સમુચ્ચિત પ્રકૃત્યા નિર્ધારણકા સાથે સબૈ તહમા ગુનાસો સુનુવાઈ તથા વ્યવસ્થાપનકા લાગિ સંસ્થાગત સંયન્ત્ર સ્થાપના ગરિ (ગુનાસો તથા સુભાવ સુન્ને અધિકારી તોકને)
- ગુનાસો સુનુવાઈ સંયન્ત્રકો પ્રત્યેક તહકો કામ કર્તવ્ય, અધિકાર ર જિમ્મેવારી ર ઉત્તરદાયિત્વ સ્પષ્ટ ગર્ને ,
- ગુનાસો વ્યવસ્થાપનલાઈ પ્રભાવકારી બનાઉન સમ્બદ્ધ સબૈકો ક્ષમતાકો વિકાસ ગરિ ગુનાસો સમ્બોધન એવં વ્યવસ્થાપનમા પ્રભાવકારિતા વૃદ્ધિ ગર્ને, ગાઉંપાલિકા ભિત્ર સંચાલિત આયોજના/કાર્યક્રમહરુ સંચાલનકા ક્રમમા આઉન સક્ને બાધા તથા જોખિમ ન્યુનીકરણ ગર્ન અનુકુલ વાતાવરણ શ્રૂજના ગર્ને ,
- નાગરિકકા ગુનાસો સમ્બોધનકા લાગિ અભિલેખિકરણ, અનુગમન પ્રતિવેદન, તથા સમીક્ષા પ્રણાલી વ્યવસ્થિત ગર્ને ,
- ગુનાસો સમ્બોધન તથા વ્યવસ્થાપન પ્રક્રિયાલાઈ છિટો છીરીતો ર પ્રભાવકારી બનાઉને ,
- ગુનાસો સમ્બોધન તથા વ્યવસ્થાપન તથ્ય ર પ્રમાણકો આધારમા સમ્પન્ન ગર્ને ।

#### **૧.૩. પરિભાષા:**

- (ક) “અધ્યક્ષ” ભન્નાલે વિજયનગર ગાઉંપાલિકાકો અધ્યક્ષ સમ્ભન્ન પર્દ્ધ ।
- (ખ) “અધિકાર પ્રાપ્ત અધિકારી” ભન્નાલે ગુનાસો છાનવિન તથા વ્યવસ્થાપન ગર્ન તોકિએકો અધિકૃત વા કર્મચારી ભન્ને સમ્ભન્નપર્દ્ધ
- (ગ) “ઉપાધ્યક્ષ” ભન્નાલે વિજયનગર ગાઉંપાલિકાકો ઉપાધ્યક્ષ સમ્ભન્ન પર્દ્ધ ।
- (ઘ) “એન” ભન્નાલે સ્થાનીય સરકાર સંચાલન એન, ૨૦૭૪ લાઈ સમ્ભન્ન પર્દ્ધ ।
- (ડ) “કાર્યપાલિકા” ભન્નાલે વિજયનગર ગાઉંપાલિકાકો કાર્યપાલિકા સમ્ભન્ન પર્દ્ધ ।





## गुनासो सम्बोधन तथा सुभाव व्यवस्थापन कार्यविधि २०८१

(च) “कार्यविधि” भन्नाले विजयनगर गाउँपालिकाबाट लागु गरिएको “गुनासो सम्बोधन तथा सुभाव व्यवस्थापन कार्यविधि, २०८१” सम्झनु पर्छ ।

(छ) “गुनासो सुन्ने अधिकारी” भन्नाले विजयनगर गाउँपालिका र यस अन्तर्गतका कार्यालयहरूले गुनासो सुन्नका लागि तोकिएको अधिकृत वा कर्मचारी भन्ने सम्झनुपर्छ ।

(ज) “गुनासो” भन्नाले नाम ठेगाना उल्लेख गरी वा नगरी सार्वजनिक सेवा प्रवाहमा ढिलासुस्ति, अनावश्यक भन्नफट, सेवा प्राप्तिमा कठिनाई, सेवाको उपलब्धता तथा सोको गुणस्तरका बारेमा असन्तुष्टि लगायत आर्थिक अनियमितता गर्न वा हुन लागेको सम्बन्धमा प्राप्त लिखित, फोन वा अन्य सञ्चारमाध्यमबाट प्राप्त समाचार, इमेल तथा इन्टरनेटबाट गाउँपालिकामा प्राप्त जानकारी तथा सूचना समेतलाई सम्झनुपर्छ । साथै कुनै सेवाग्राहीले कार्यालयमा आई मौखिकरूपमा वा फोन मार्फत गरेको गुनासो समेतलाई त्यस्तो सेवा प्रदायक कार्यालयले निजको गुनासोलाई व्यवस्थित गर्नेछ र यसलाई गुनासो मानिने छ । सम्भव भएसम्म त्यसरी प्राप्त मौखिक गुनासोलाई उतार गरी सम्बन्धित व्यक्तिको दस्तखत गरी राख्ने व्यवस्था गुनासो सुन्ने अधिकारीले गर्नेछ । सुभाव भन्नाले विजयनगर गाउँपालिका अन्तर्गतका विभिन्न आयोजना/कार्यक्रमहरू बारे प्रतिक्रिया वा सल्लाहलाई सम्झनु पर्छ ।

(झ) “जानकारी” भन्नाले विजयनगर गाउँपालिकाले प्राप्त गरेको उजुरी, गुनासो सम्बन्धी कुनै पनि सूचनालाई सम्झनु पर्छ ।

(ज) “निरीक्षण” भन्नाले विजयनगर गाउँपालिकाको तर्फबाट गरिने छड्के जाँच वा निरीक्षणलाई सम्झनुपर्छ ।

(ट) “पदाधिकारी” भन्नाले गाउँपालिकाका अध्यक्ष, उपाध्यक्ष, बडा अध्यक्ष तथा कार्यपालिकाका अन्य सदस्यहरू सम्झनुपर्छ ।

(ठ) “पालिका” भन्नाले विजयनगर गाउँपालिका सम्झनु पर्छ ।

(ड) “प्रमुख प्रशासकीय अधिकृत” भन्नाले विजयनगर गाउँपालिकाका प्रमुख प्रशासकीय अधिकृत सम्झनु पर्छ ।

(ढ) “विषयगत कार्यालय” भन्नाले विजयनगर गाउँपालिका अन्तर्गतका विभिन्न विषयगत कार्यालय समेतलाई सम्झनु पर्छ ।

(ण) “संविधान” भन्नाले नेपालको संविधान, २०७२ सम्झनु पर्छ ।

(त) “स्थानीय कानून” भन्नाले गाउँ सभाले बनाएको कानून सम्झनु पर्छ ।

### परिच्छेद-२ गुनासो प्राप्ती, प्राथमिकीकरण तथा वर्गीकरण

#### २.१. गुनासोका वर्गीकरण :

सामान्यतया स्थानीय तहमा संचालित कार्यक्रम तथा स्थानीय स्तरमा प्रदान गरिने सेवा सम्बन्धी गुनासोहरूलाई निम्न लिखित रूपमा वर्गीकरण गर्न सकिनेछ ।

- ❖ नागरिकले जानकारी माग गरेका सूचना सम्बन्धी गुनासो ,
- ❖ एक पक्षको क्रियाकलापबाट अर्का पक्षलाई मर्का परेको सम्बन्धी गुनासो ,
- ❖ कार्य प्रक्रिया सम्बन्धी गुनासो ,
- ❖ आर्थिक अनुशासन सम्बन्धी गुनासो ,
- ❖ सेवा प्रवाह सम्बन्धी गुनासो ,
- ❖ सार्वजनिक एवं स्थानीय पूर्वाधार विकास सम्बन्धी गुनासो ,
- ❖ आयोजना (तर्जुमा, कार्यान्वयन अनुगमन मूल्यांकन) सम्बन्धी गुनासो ,
- ❖ सार्वजनिक जग्गा अधिकरण तथा मुआब्जा सम्बन्धी गुनासो ,
- ❖ संघ र प्रदेशबाट प्राप्त गुनासो,
- ❖ नीतिगत गुनासो,
- ❖ अन्य गुनासो ।

#### २.२. उजुरी तथा गुनासो प्राप्त गर्ने माध्यम :

स्थानीय स्तरमा संचालित आयोजनाहरूसंग सम्बन्धित उजुरी तथा गुनासो देहाय बमोजिम प्राप्त गर्न सकिन्छ :

गोपनीय दिव्यालय  
प्रमुख प्राप्तिको संचयन

गोपनीय दिव्यालय  
प्रमुख  
विवाह विभाग  
गुनासोहरूलाई सम्झनु पर्ने अधिकृत  
विवाह विभाग गाउँपालिका



- मौखिक (कार्यालयमा उपस्थित भएर वा छरछिमेक वा आफन्त उपस्थित भएर) ,
  - निवेदन दर्ता गराएर ,
  - टेलिफोन, प्याक्स, हटलाईन (पालिकाको टेलिफोन नं....., प्याक्स नं..... र हटलाईन नं....., टोल फ्रि नं. बाट गर्न सक्ने छन् ।
  - ईमेल, एस.एम.एस., भाइबर, ह्वाट्सएप वा अन्य सामाजिक सञ्जाल (पालिकाको ईमेल ठेगाना....., एस.एम.एस. गर्ने नम्बर.....र सामाजिक सञ्जालको विवरण.....हुन सक्नेछन्
  - हुलाक वा एक्स्प्रेस डेलिभरिबाट
  - उजुरी/सुझाव पेटिका ,
  - पत्रपत्रिका एवं विद्युतीय संचार ,
  - सार्वजनिक परीक्षण, सार्वजनिक सुनुवाई आदि जस्ता नागरिकका निगरानीबाट प्राप्त पृष्ठपोषण तथा सुझाव ,
  - माधिल्लो तहबाट प्राप्त सुझाव, निर्देशन मार्फत ।

**२.४ गुनासोको जाँच:** गुनासो सुन्ने अधिकारीले प्राप्त गुनासोको जाँच गर्ने क्रममा गुनासोकर्ता र गुनासोको विषय वीचको तादम्यता, स्थानीय तहको अधिकार क्षेत्र, गुनासोको औचित्य, सान्दर्भिकता, सघनता समेतको आँकलन गरी गुनासो सम्बोधन गर्न सकिने वा नसकिने निर्णय गर्नु पर्नेछ ।

## २.३. गुनासो सम्बोधनको स्थान र समय :

स्थानीय स्तरमा संचालित पूर्वाधार विकास सम्बन्धी गुनासाहरुको सम्बोधन यथासक्य छिटो /छरितो गर्ने व्यवस्था मिलाउनु पर्नेछ । सामान्यतया प्राप्त गुनासोहरु मध्ये सुचना तथा जानकारी माग गरिएका गुनासोहरु भएमा २४ घण्टा भित्र सम्बोधन गर्नु पर्दछ । सुचनाको माग वडा कार्यालयबाट भए सम्बन्धित वडा तथा गाउँपालिकाबाट भए गाउँपालिकाबाट गुनासोको सम्बोधन गर्नु पर्नेछ । यसको अलावा गुनासोका प्रकृति अनुसार देहाय बमोजिम सम्बोधन गरि प्रक्रियाको स्थितिको बारेमा गुनासोकर्तालाई जानकारी उपलब्ध गराईनेछ ।

२.४. गुनासो प्रकृति अनुसार फ्लूयॉट हन लाग्ने समय

गुनासोको स्तर	गुनासोको प्रकृति	समयावधी
अति संवेदनशिल	<ul style="list-style-type: none"> <li>● कुनै पनि हानिबाट बच्न तुरुन्तै कदम चाल्नुपर्ने जीवन रक्षक घटनाहरू</li> <li>● गाउँपालिकाको प्रतिष्ठा वा परिचालनमा असर पर्न सक्ने कार्य / घटनाहरू</li> <li>● संरक्षण, लैङ्गिक हिंसा, जालसाजी वा भ्रष्टाचारका विषयहरु</li> <li>● स्थानिय तह कर्मचारी वा सामेदारहरू द्वारा दुर्व्यवहार जस्तै : दुर्व्यवहार, जबर्जस्ती, वा कुनै पनि प्रकारको शोषण</li> <li>● श्रोतहरूको दुरुपयोग, जस्तै अपचलन, भ्रष्टाचार र चोरी</li> <li>● सुरक्षा सम्बन्धि घटनाहरू वा लाभार्थीद्वारा अनुभव गरिएको हानि, जस्तै : शारीरिक शोषण वा यौन हिंसा</li> </ul>	२४ घण्टाभित्र अनुसन्धान प्रक्रिया शुरु
संवेदनशिल	<ul style="list-style-type: none"> <li>● स्थानिय तहका कार्यक्रम सम्बन्धि जिज्ञासा</li> <li>● पालिकाका कार्यक्रममा ढिलाइ वा हानि हुन सक्ने</li> </ul>	बढीमा पाँच दिन भित्र
साधारण	सामान्य जिज्ञासाहरू जसले कुनै पनि तत्काल प्रभाव वा असर पाईन	सात देखि पन्थ दिन भित्र
कारवाही सम्बन्धी:		३ महिना भित्र



वडा कार्यालय मार्फत माग भएका तर गाउँपालिका संग सम्बन्धित गुनासोहरु वडा कार्यालयले दर्ता गरि गाउँपालिकामा पठाईने व्यवस्था मिलाईने छ, भने वडा कार्यालय संग सम्बन्धित तर पालिकामा दर्ता भएका गुनासोलाई पनि वडामा पठाउनु पर्ने छ, र दर्ता भएको अवस्थामा गुनासोको प्रकृति हेरी निश्चित समयावधी भित्र पठाई सक्नुपर्नेछ ।

### परिच्छेद-३ गुनासो व्यवस्थापन

#### ३.१. गुनासो व्यवस्थापन सम्बन्धी व्यवस्था :

गाउँपालिका वा यसको मातहतमा प्राप्त वा दर्ता गर्दा सबैभन्दा पहिला गुनासो विस्तृतमा टिपोट गर्ने र त्यसको गम्भिरता, प्रकृति साथै विषयगत र सम्बन्धित निकाय अनुसार छुट्याउने । विभिन्न समूहका विभिन्न किसिमका गुनासाहरु हुनसक्छन् समुह अन्तर्गत गुनासाहरु पहिचान गर्न र त्यसै अनुसार कार्यक्रम समायोजन गर्दै सुदृढ बनाउन गुनासो कर्ताको लिङ्ग, उमेर, ठेगाना जस्ता विवरण लिन आवश्यक छ । कुनै गुनासाहरु प्रवाह गर्नुपरेमा गुनासोकर्ताका व्यक्तिगत विवरण लिनुपर्ने हुन्छ । गुनासो गरेर गुनासोकर्तालाई हानि नहुने सुनिश्चित गर्न यी सबै विवरणहरुको गोपनियता कायम गर्न आवश्यक छ ।

गाउँपालिका वा यसको मातहतमा प्राप्त वा दर्ता भएका गुनासोहरु सबै तहहरुले आ-आफ्नो तहमा गुनासो व्यवस्थापन गर्न बनाईएका समितिहरुमा गुनासाहरुका गम्भिरता र प्रकृति स्पष्ट रूपमा छुट्याइ पेश वा रेफर गर्नु पर्नेछ । समितिले उक्त गुनासोहरु हेरी छलफल गरी आवश्यकता अनुसार कार्बाही वा छानबिन प्रक्रिया अगाड बढाउने र निर्णय गरी व्यवस्थापन गर्नु पर्नेछ । यदि नसकिने भए आफू भन्दा माथिल्लो समितिमा निर्णय गरी व्यवस्थापनको लागी पठाईने छ, र यसरी पठाईएको बारे जानकारी सम्बन्धित गुनासो कर्तालाई गराईने छ । गुनासो तथा उजुरीहरुलाई थप व्यवस्थित र प्रभावकारी बनाउन निम्नानुसारको संस्थागत संरचना तयार गरीएको छ, भने उक्त संरचनाहरुको काम कर्तव्य देहाय अनुसार रहेको छ :

#### ३.२. उपभोक्ता समितिबाट गरिनु पर्ने गुनासो व्यवस्थापन:

- उपभोक्ता समिति आफैले कार्यान्वयन गर्ने योजनाको सम्बन्धमा मुल समिति मध्येबाट एक (१) जना गुनासो व्यवस्थापन अधिकारी तोक्नु पर्ने छ ।
- यसरी तोकिएको गुनासो व्यवस्थापन अधिकारीले उक्त आयोजनाका सम्बन्धमा गुनासोको अभिलेखिकरण, वर्गीकरण गर्ने छ ।
- गुनासोको आवश्यकताको आधारमा कम्तीमा महिनाको एकपटक समितिमा छलफल गरी सम्बोधन गर्नुपर्ने छ । गुनासो सम्बोधनको लागि वडा तथा गाउँपालिकाको सहयोग र समन्वय आवश्यक भएमा सम्बन्धित निकायमा अनुरोध गर्न सक्ने छ, र यसरी अनुरोध भई आएको खण्डमा वडा तथा गाउँपालिकाको कार्यालयबाट यस विषयसंग सम्बन्धित १ जना व्यक्ति खटाईने छ ।
- गुनासो व्यवस्थापन तथा सम्बोधनको समिक्षाको प्रतिवेदन वडा कार्यालयमा पठाउनु पर्ने छ ।
- वडा कार्यालय, अन्य शाखा तथा गाउँपालिकाको कार्यालय (माथिल्लो तह) बाट प्राप्त गुनासोको अभिलेख राखी समिति मार्फत व्यवस्थापन गर्नु पर्ने छ । यसरी व्यवस्थापन गरीएको कुराहरु समितिको निर्णयमा उल्लेख हुनु पर्ने छा ।

#### ३.३. वडा तहको गुनासो व्यवस्थापन समिति: वडा तहमा गुनासो व्यवस्थापन समिति निम्नानुसारको रहने छ :

सम्बन्धित वडाको वडा अध्यक्ष –

संयोजक

कार्यालय/प्राविधिक सहायक –

सदस्य

निर्वाचित महिला सदस्य १ (एक) जना (वडा समितिले तोके अनुसार) – सदस्य

विपक्षी दलका निर्वाचित वा अन्य सदस्यहरु मध्येबाट १ (एक) जना – सदस्य

वडा सचिव – सदस्य सचिव

गोपनीय वडा अध्यक्ष  
प्रमुख प्रशासकीय अधिकारी

गोपनीय वडा अध्यक्ष  
प्रमुख प्रशासकीय अधिकारी



**३.४. वडा तहमा गुनासो व्यवस्थापन देहाय अनुसार गरिनेछ :**

गुनासो विषयसंग सम्बन्धित अन्य व्यक्ति वा पदाधिकारीलाई आवश्यकता अनुसार गुनासो व्यवस्थापन समितिको बैठकमा आमन्त्रण गर्न सकिने छ ।


- वडाको गुनासो व्यवस्थापन समितिको सचिवालय सम्बन्धित वडा कार्यालयमा रहने छ ,
- यस पालिकाको कार्यालयमा विभिन्न माध्यम र विभिन्न तहबाट प्राप्त गुनासोहरुको अनुसूची १ बमोजिम अभिलेखिकरण र अनुसूची २ बमोजिम वर्गिकरण गरि गुनासो व्यवस्थापन समितिको बैठकमा पेश गरिने छ । यो कामको जिम्मेवारी सदस्य सचिवको हुनेछ, साथै गुनासो व्यवस्थापन समितिबाट भएका निर्णयहरु कार्यान्वयन गर्ने गराउने जिम्मेवारी पनि सदस्य सचिवमा निहित रहने छ ,
- प्राप्त गुनासोहरुलाई वडा कार्यालयबाट सम्बोधन हुन सक्ने वा हुन नसक्ने गरी २ भागमा बाँडी, वडा कार्यालय मार्फत सम्बोधन, व्यवस्थापन हुन नसक्ने गुनासोहरुलाई सम्बन्धित तहरुमा (उपभोक्ता समितिको हकमा उपभोक्ता समितिमा र अन्यको हकमा विजयनगर गाउँपालिकामा) पठाउनु पर्ने छ र त्यसरी पठाईएको कुराको जानकारी गुनासोकर्तालाई जानकारी गराईने छ ,
- गुनासो वडा कार्यालय वा वडाको मातहतमा रहेका शाखाको कर्मचारीसँग सम्बन्धित भएमा वडा कार्यालयबाटे सम्बोधन गर्नु पर्ने छ र वडाका निर्बाचित प्रतिनिधिहरु मध्ये अध्यक्षको हकमा विजयनगर गाउँपालिकामा सिफारिस गर्नुपर्ने छ ।
- भ्रष्टाचारसँग सम्बन्धित गुनासो भएमा वडा कार्यालयले तथ्य र राय सहितको सिफारिस विजयनगर गाउँपालिकामा पेश गर्नुपर्ने छ ,
- ठेक्का-पट्टा प्रक्रियाबाट कार्यान्वयन गरिएको योजनाको हकमा गुनासो सम्बन्धी सूचना विजयनगर गाउँपालिकामा पठाउनु पर्नेछ ,
- सार्वजनिक जवाफदेहिताका औजारहरु सार्वजनिक सुनुवाई, सार्वजनिक परीक्षण आदिको माध्यमबाट प्राप्त गुनासो सुभावलाई पनि वडाले सम्बोधन गर्नु पर्ने छ, भने यस्तो कार्यक्रमबाट उठेका माथिल्लो तहको सुभाव वा गुनासोलाई वडाले प्रतिवेदन मार्फत विजयनगर गाउँपालिकामा पठाउनु पर्ने छ ,
- वडा कार्यालयमा दर्ता भएका तथा माथिल्लो तहबाट प्राप्त गुनासो, सुभाव र उजुरीहरुलाई नियम २.४ बमोजिम व्यवस्थापन गर्नु पर्ने छ ,
- प्रत्येक महिना वडा स्तरीय गुनासो व्यवस्थापन समितिको बैठक बसि गुनासो व्यवस्थापनको सवालमा भएका कामहरुको समिक्षा गरी सो को प्रतिवेदन वडा कार्यालयले विजयनगर गाउँपालिकामा सिफारिस गर्नु पर्ने छ ,
- समितिले गुनासो सम्बोधन गर्दा गुनासो संग सम्बन्धित पदाधिकारी वा कर्मचारीलाई आमन्त्रण गर्न सक्ने छ ,
- वडामा संचालित विभिन्न आयोजना वा संघ सस्था संग सम्बन्धित गुनासोहरुलाई वडाको गुनासो व्यवस्थापन समितिले आवश्यकता अनुसार सम्बन्धित संघ सस्थालाई रेफर गर्ने वा आवश्यक नपरे छलफल गरि निर्णय सहित सम्बन्धित कार्यालयमा पठाई समयमा गुनासो सम्बोधन गरि वडा कार्यालयलाई जानकारी गर्न निर्देशित गर्नु पर्ने छ ,
- वडा कार्यालयले गुनासोको सम्बोधन गरी सके पश्चात वडा कार्यालयको सुचना बोर्डमा सूचना टाँस गर्नु पर्नेछ भने सम्बन्धित गुनासोकर्तालाई पनि सोको जानकारी पठाउनु पर्ने छ ।

**३.५. गाउँपालिका तहमा गुनासो व्यवस्थापन समिति सम्बन्धी व्यवस्था:**

गाउँपालिका तहमा गुनासो व्यवस्थापन समिति निम्न अनुसार हुनेछ :

गाउँपालिकाको अध्यक्षः	संयोजक
गाउँपालिकाको उपाध्यक्षः	उप-संयोजक
पूर्वाधार विकास शाखा प्रमुखः	सदस्य
कुनै १ वडाको वडा अध्यक्षः	सदस्य
गाउँपालिकाको प्रमुख प्रशासकीय अधिकृतः	सदस्य सचिव

**३.६. गाउँपालिका स्तरमा गुनासो व्यवस्थापन देहाय अनुसार गरिनेछ:-**





- ગુનાસો વિષયસંગ સમ્વન્ધિત અન્ય વ્યક્તિ વા પદાધિકારીલાઈ આવશ્યકતા અનુસાર ગુનાસો વ્યવસ્થાપન સમિતિકો વૈઠકમા આમન્ત્રણ ગર્ન સકિને છે ,
- પાલિકા ગુનાસો વ્યવસ્થાપન સમિતિકો સચિવાલય સમ્વન્ધિત વિજયનગર ગાઉંપાલિકાકો કાર્યાલયમા રહને છે, ભને આવશ્યકતા અનુસાર ગુનાસો વ્યવસ્થાપન ડેસ્ક વા સહાયતા કક્ષકો નિર્માણ ગર્ન સકિને છે ,
- પાલિકાકો કાર્યાલયમા વિભિન્ન માધ્યમ ર બિભિન્ન તહબાટ પ્રાપ્ત ગુનાસોહરુકો અનુસૂચી-૧ બમોજિમ અભિલેખિકરણ ર અનુસૂચી-૨ બમોજિમ વર્ગિકરણ ગરિ ગુનાસો વ્યવસ્થાપન સમિતિકો વૈઠકમા પેશ ગરિને છે। યો કામકો જિમ્મેવારી સદસ્ય સચિવકો રહને છે, સાથે ગુનાસો વ્યવસ્થાપન સમિતિવાટ ભએકા નિર્ણયહરુ કાર્યાન્વયન ગર્ને ગરાઉને જિમ્મેવારી પનિ સદસ્ય સચિવમા નિહિત રહને છે ,
- પ્રાપ્ત ગુનાસો સ્થાનીય ઉપભોક્તા સમિતિ તથા વડા કાર્યાલયસંગ સમ્વન્ધિત ભએમા સો સમ્વોધન ગર્ન સમ્વન્ધિત ઉપભોક્તા સમિતિમા ર વડા કાર્યાલયમા પઠાઉને ર નિર્દેશન દિને કાર્ય ગર્નું પરિનિર્ણય ર ગાઉંપાલિકા ભન્દા માધિલ્લો તહમા પઠાઉને ગુનાસો ભએ માધિલ્લો તહમા પઠાઈને છે। યસરી પઠાઇએકો કુરાકો સવૈકો જાનકારીકો લાગી સૂચના માર્ફત પ્રકાશિત ગર્નું પર્ને છે ,
- પાલિકા તથા યસકા શાખા અન્તર્ગતકા કર્મચારીહરુસંગ સમ્વન્ધિત ગુનાસોહરુ ગાઉંપાલિકાવાટૈ સમ્વોધન ગરિને છે ,
- પાલિકામા સંઘ ર પ્રદેશ માર્ફત સંચાલિત ક્રિયાકલાપ તથા આયોજના સંગ સમ્વન્ધિત ગુનાસાહરુકો હકમા, (ક) ઠેકા માર્ફત સંચાલિત આયોજના સંગ સમ્વન્ધિત ગુનાસોહરુ ભએમા પાલિકાકો સમન્વયમા ઠેકેદાર માર્ફત આફૈ વા પ્રતિનિધિકો ઉપસ્થિતિમા ગુનાસો સમ્વોધન ગર્ન લગાઉને (ખ) અન્ય ક્રિયાકલાપકો ગુનાસોકો હકમા સંઘ ર પ્રદેશમા ગુનાસો સમ્વોધનકો લાગી અનુરોધ ગરી પઠાઉને વ્યવસ્થા મિલાઈને છે ,
- ઉજુરી તથા ગુનાસોહરુકો વિવરણલાઈ સૂચના પ્રવિધિકો વિચુટીય પ્રણાલીમા આવદ્વ ગર્ને પ્રયાસ ગરિને છે ,
- નાગરિકહરુકા ગુનાસોહરુલાઈ સહજ રૂપમા વ્યવસ્થાપન ગર્ન ઈમેલ, SMS, સામાજિક સંજ્ઞાલ, ભાઇબર, હ્વાટ્સએપ, મોબાઇલ, ટેલિફોન, હટલાઈન આદિકો વ્યવસ્થા ગરિને છે ,
- ગુનાસો રહિત પાલિકા નિર્માણકો લાગી સવૈ પક્ષકાળાઈ પરિચાલન ગરિને છે ,
- વડા કાર્યાલયકો ગુનાસો વ્યવસ્થાપન અવસ્થાકો અનુગમન ગરી આવશ્યક નિર્દેશન દિને કાર્ય ગર્ને છે ,
- પાલિકા ગુનાસો વ્યવસ્થાપન સમિતિલે પ્રાપ્ત ગુનાસોહરુકો અવસ્થાલાઈ હેરી આવશ્યકતાકો આધારમા કર્મતીમા પ્રત્યેક મહિનામા એકપટક સમિક્ષા ગરી સો કો પ્રતિવેદન જિલ્લા સમન્વય સમિતિ, પ્રદેશકો મન્ત્રાલયમા પઠાઉને ર આફોનો કાર્યાલયકો સૂચનાપાટી ર Website મા અધ્યાવધિક ગર્ને સાથે વડા કાર્યાલય માર્ફત વ્યવસ્થાપન હુન નસકિ ગાઉંપાલિકામા સિફારીસ ગરીએકા ગુનાસાકો સમ્વોધન ગરી ગાઉંપાલિકાલાઈ લિખિત જાનકારી પઠાઉનું પર્ને છે ,
- સાર્વજનિક જવાફદેહિતાકા ઔજારહર (સાર્વજનિક સુનુવાઈ, સાર્વજનિક પરીક્ષણ આદિ) કો માધ્યમબાટ પ્રાપ્ત ગુનાસો તથા સુભાવલાઈ સમ્વોધન ગર્નું પર્ને છે ,
- ગુનાસો વ્યવસ્થાપનમા સંલગ્ન કર્મચારીકો દક્ષતા અભિવૃદ્ધિકો લાગી ક્ષમતા વિકાસકા કાર્યક્રમ તર્જુમા ગરી કાર્યક્રમ સંચાલન ગર્ને ,
- ગુનાસો વ્યવસ્થાપન સમિતિલે સવૈ ગુનાસો વ્યવસ્થાપન સમ્વન્ધિ ગરિએકા ક્રિયાકલાપહરુકો વિવરણ પાલિકામા પેશ ગર્ને છે ભને નિતિગત ગુનાસાકો સવાલમા નાગરિક મૈત્રી નિતિ નિર્માણકો લાગી સમ્ભાવિત નિતિહરુકો સુફાવ વિવરણ સહિતકો પ્રતિવેદન પનિ પેશ ગર્નું પર્નેછે ,
- ગુનાસો વ્યવસ્થાપનકો વાર્ષિક વિવરણ તયાર ગરી પ્રકાશન ગર્ને ।

#### પરિચ્છેદ-૪ ગુનાસો વ્યવસ્થાપન સમ્વન્ધી પ્રકૃયાગત વ્યવસ્થા

##### ૪.૧. સ્વત સૂચના પ્રકાશન ગર્નુંપર્ને

- નેપાલકો સમ્વિધાન ૨૦૭૨ કો ધારા ૨૭ અનુસાર પ્રત્યેક નાગરિકલાઈ સાર્વજનિક સરોકારકો કુનૈ પનિ વિષયકો સૂચના માગ્ને ર પાઉને હક હુને ભએકાલે સમ્વન્ધિત કાર્યાલયલે પ્રત્યેક તીન મહિનામા સ્વત રૂપમા સાર્વજનિક ચાસોકો વિષય સંગ સમ્વન્ધિ સૂચના પ્રકાશન ગર્નું પર્ને છે ।

ગુનાસો વ્યવસ્થાપન સમિતિ  
સરોકારકો કુનૈ પનિ વિષયકો સૂચના પ્રકાશન ગર્નું પર્ને છે

ગુનાસો વ્યવસ્થાપન સમિતિ  
સરોકારકો કુનૈ પનિ વિષયકો સૂચના પ્રકાશન ગર્નું પર્ને છે



- कार्यालयले सार्वजनिक सेवा तथा कामहरुको विषयमा आएका गुनासोहरु सुनुवाइका लागि गुनासो सुनुवाइ अधिकारीको व्यवस्था गर्नु पर्ने छ ।

#### ४.२ गुनासो सम्बोधन प्रक्रिया:

- गुनासोको उजुरी प्राप्तिको जानकारी सम्बन्धित सरोकारवालालाई नियमित गराई राख्ने ,
- गुनासो दर्ता नम्वर सहित समाधान हुन सक्ने अनुमानित समय समेत गुनासोकर्तालाई प्रदान गर्नु पर्ने छ ,
- प्रकृयाको सम्बन्धमा गुनासोकर्तालाई उचित सल्लाह दिने र कुन तहबाट समाधान हुन सक्ने हो, सो को समेत जानकारी दिईने छ ,
- यदि गुनासोकर्ताको व्यक्तिगत विवरण लिनु परेमा वा सो विवरण गुनासो समाधान गर्ने प्रक्रियामा सम्बन्धित व्यक्ति वा समितिलाई पठाउन परेमा गुनासोकर्तालाई सो विवरण कुन निकायलाई पठाउने भन्नेबारे खुलस्त जानकारी गराउने र सो को लागि अनुमति लिने । सो विवरणको गोपनियताबारे पनि जानकारी गराउने ।
- विद्युतीय माध्यमबाट प्राप्त उजुरीको स्वतः जवाफ दिने व्यवस्था क्रमशः मिलाउँदै जाने ,
- उजुरी सम्बोधन भएको जानकारी गुनासोकर्तालाई तुरुन्त दिने ,
- गुनासो सम्बोधन प्रकृयाका सम्बन्धमा स्थानीयस्तरको परिस्थितिको विश्लेषण गरी औपचारिक वा अनौपचारिक माध्यम अवलम्बन गरी सम्बोधन गरिने छ ।

#### ४.३. गुनासो व्यवस्थापनको कार्य प्रक्रिया:

- गाउँपालिका मातहातका सबै कार्यालयहरुमा अनिवार्य रूपमा सबैले देखन सक्ने गरी गुनासो/सुभाव पेटीका राख्नु पर्ने छ, यसरी राखिने गुनासो तथा सुभाव पेटीका अपाङ्गता मैत्री भएको सुनिश्चितता गरिनेछ, र अन्य माध्यमबाट प्राप्त गुनासोहरुलाई पनि गुनासो दर्ता रजिस्टर मार्फत सबै कार्यालयहरुमा दर्ता गरिने छ र विद्युतीय माध्यमबाट प्राप्त गुनासोहरुलाई पनि अभिलेखिकरण गरिने छ ।
- जिम्मेवारी प्राप्त अधिकारी (यस कार्यविधि अनुसार गुनासो व्यवस्थापन समितिको सदस्य सचिव) ले प्रत्येक सात दिनमा एक पटक समितिको रोहबरमा गुनासोको बर्गीकरण गरी अभिलेखीकरण गर्ने र प्राप्त गुनासोको बर्गीकृत विवरण गुनासो व्यवस्थापन समितिमा पठाउने छ ,
- सम्बोधन गर्न नसकिने गुनासोलाई आफु भन्दा माथिल्लो तहको गुनासो व्यवस्थापन समितिमा पठाउने तर यसको जानकारी गुनासोकर्तालाई गराउनु पर्ने छ ,
- गुनासो सम्बन्धी निकायका कर्मचारीको वैयक्तिक आचरणसँग सम्बन्धित भएमा आफ्नो तर्फबाट गर्नुपर्ने कारवाही गरी सो को विवरण माथिल्लो निकायमा पठाउनु पर्ने छ , साथै त्यस्तो विवरणको जानकारी सार्वजनिक सूचना मार्फत पनि जानकारी गर्नुपर्ने छ ।
- गुनासो गर्ने गुनासोकर्ताबाट आफुलाई दिएको गुनासो फिर्ता मागेमा फिर्ता दिने र सम्बन्धित कार्यालयसँग सम्बन्धित नभएको गुनासो पनि गुनासोकर्तालाई फिर्ता गर्ने । गुनासोकर्ताको पहिचान नभएमा सो को जानकारी सूचना पाठीमा राखिने छ ।
- गुनासो सम्बोधनको प्रारम्भिक चरणमा सम्बन्धित निकायमा तोकिएको गुनासो सुन्ने अधिकारीले प्राप्त गुनासो अनुसूची-१ बमोजिम अभिलेखिकरण गर्ने र प्राप्त गुनासोलाई प्राप्त भएको मितिले २४ घण्टा भित्र गुनासो व्यवस्थापन समितिको संयोजक समक्ष पेश गर्नुपर्ने छ । गुनासो सुन्ने अधिकारीबाट तत्काल सम्बोधन हुन सक्नेलाई सम्बोधन गर्ने र नसक्नेलाई समिति मार्फत सम्बोधन गर्न निर्देशन गरिने छ ।
- गुनासोकर्ताले सहज र सरल रूपमा गुनासो राख्न गुनासो /सुभाव पेटीका, टेलिफोन, हटलाईन, मोबाइल, सामाजिक संजाल, भाइबर, ह्वाट्सएप, एसएमएस आदिबाट दिन सक्ने व्यवस्था गर्नुपर्ने छ ,
- प्राप्त गुनासो व्यवस्थाको अध्यावधिक अवस्थाको बारेमा समय-समयमा सरोकारवालालाई स्थानीय पत्रपत्रिका, एफ.एम. रेडियो, टिभी आदिबाट जानकारी गराउनु पर्नेछ ,
- गुनासो व्यवस्थापन गर्ने क्रममा नागरिकका गुनासोको गोपनियता कायम गरिने छ ,

गोपनीय राज्यपाल  
प्रमुख प्राप्तिको समिति

गोपनीय राज्यपाल  
अध्यक्ष  
विवाह विवरण समिति



## ગુનાસો સમ્વોધન તથા સુભાવ વ્યવસ્થાપન કાર્યવિધિ ૨૦૮૧

- વિભિન્ન તહમા રહેકા નિગરાની ગર્ને નિકાય અખ્લિત્યાર દુરૂપયોગ અનુસન્ધાન આયોગ, મહાલેખા પરીક્ષકનો કાર્યાલય, સંઘય તથા પ્રદેશ સ્તરીય મન્ત્રીપરિષદ કાર્યાલય, સંસદકા વિભિન્ન સમિતિ, રાષ્ટ્રીય સતર્કતા કેન્દ્ર, મન્ત્રાલય, જિલ્લા સમન્વય સમિતિબાટ પ્રાપ્ત ગુનાસો તથા ઉજુરીલાઈ ઉચ્ચ પ્રાથમિકતા દિર્દી સમ્વોધન ગર્નુપર્ને છે ।
- વિભિન્ન તહબાટ હુને અનુગમન તથા સુપરિવેક્ષણમા ગુનાસો વિષય સમેટિએકો હુને છે ,
- ગુનાસો તથા ઉજુરીકો પ્રકૃતિકા આધારમા માથિ ઉલ્લેખિત નિયમમા વ્યવસ્થા ભાએ અનુસાર સમ્વોધન ગર્નુપર્ને છે ।

### **૪.૪. બેનામી, અસમ્બન્ધિત ઉજુરી, ગુનાસો તથા ભુઠો ઉજુરી સમ્બન્ધી વ્યવસ્થા:**

- બેનામી ઉજુરી પનિ દર્તા ગરિનેછ ર આવશ્યક છાનવિનકો પ્રકૃત્યામા રાખિનેછ । યદિ યસ વિજયનગર ગાઉંપાલિકા કાર્યાલયકો કાર્યસંગ સમ્બન્ધિત નભર્દ અન્ય નિકાય વા કાર્યાલયસંગ સમ્બન્ધિત રહેછ ભને સો કો વિવરણ માથિલ્લો તહમા પઠાઈને છે ।
- ભુદ્વા રૂપમા કસૈલાઈ દુઃખ દિને નિયતલે ઉજુરી ગરેમા પ્રચલિત કાનૂન બમોજિમ કારવાહીકા લાગિ સમ્બન્ધિત નિકાયલે કાનૂન કાર્યાન્વયન ગર્ને નિકાય, કાર્યાલયમા લેખી પઠાઉન સક્ને છે ।
- ભુઠો ગુનાસો દિર્દી નાજાયજ દુઃખ દિને ઉપર અવસ્થા હેરી જરિવાના સમેત ગર્ન સકિનેછ ।

### **૪.૫. ઉજુરી, ગુનાસો ફિર્તા સમ્બન્ધી વ્યવસ્થા:**

ઉજુરી વા ગુનાસો લિખિત રૂપમા સરોકારવાળા આવેદનકર્તાલે ફિર્તા માગેમા ફિર્તા દિન સકિનેછ । યદિ યસ ગાઉંપાલિકા કાર્યાલયકો કામ કારવાહીસંગ અસમ્બન્ધિત વિષયકો ગુનાસો પ્રાપ્ત ભાએમા સમ્બન્ધિત વ્યક્તિ પહિચાન ભાએકો રહેછ ભને સો કો વિવરણ કાર્યાલયકો સૂચના પાટી તથા વિભિન્ન સંચાર માધ્યમબાટ સાર્વજનિક જાનકારી ગરાઉનુ પર્નેછ ।

### **૪.૬. ગુનાસોકા અભિલેખિકરણ તથા પ્રતિવેદન :**

ગુનાસોકા વ્યવસ્થિત અભિલેખિકરણ તથા પ્રતિવેદનકા લાગિ ગાઉંપાલિકા ર વડાસ્તરમા ભિન્ના ભિન્ના રૂપમા એક જના કર્મચારીલાઈ જિસ્મેવારી દિનુપર્નેછ । યસરી જિસ્મેવારી તોકિએકો કર્મચારીલે અનુસૂચી ૧ મા ઉલ્લેખિત ફારામમા ગુનાસોકા અભિલેખિકરણ તથા અનુસૂચિ ૩ મા ઉલ્લેખિત ફારામમા પ્રતિવેદન તયાર ગરી સમ્બન્ધિત નિકાયમા પેશ ગર્નુ પર્દછ ।

### **૪.૭. ગુનાસો સમ્બન્ધી ગોપનિયતા :**

પ્રત્યેક તહમા કાર્યરત સમ્બદ્ધ સમિતિ તથા વ્યક્તિહરૂલે નાગરિકકા ગુનાસા ગોપ્ય રાખ્યુપર્ને ભાએમા ગોપનિયતા કાયમ રાખ્યે ગુનાસોકો સમ્વોધન ગર્નુપર્દછ ર સમ્બન્ધિત સરોકારવાળાકો સ્વિકૃતિ વેગર ખુલાસા ગર્નુ હુદૈન । ગોપ્ય રાખ્યુપર્ને ગુનાસોકો સમ્વોધન ગુનાસોકર્તાકો ગોપનિયતા કાયમ રાખેર નૈ ગુનાસો સમ્બન્ધી કામ કાર્વાહી અગાડિ બઢાઉનુ પર્દછ ।

### **૪.૮ સ્થાનીય તહમા ગુનાસો વ્યવસ્થાપનકા લાગિ પ્રયોગમા લ્યાઇએકા સમ્પર્ક માધ્યમરુ દેહાય બમોજિમ રહેકા છન્ન :**

ટોલ ફ્રિ નં :

ફોન નં :

ઇમેલ ઠેગાના:

સૌનાસો સમ્વોધન વિભાગ  
સર્વુલ પ્રાણીકોને જરૂરિયત

ગુનાસો સમ્વોધન વિભાગ  
સર્વુલ પ્રાણીકોને જરૂરિયત  
દેહાય બમોજિમ



ગુનાસો સમ્વોધન તથા સુભાવ વ્યવસ્થાપન કાર્યવિધિ ૨૦૮૧

**અનુસૂચી ૧**

વિજયનગર ગાઉંપાલિકા, .....નં. વડા કાર્યાલય .....

**ગુનાસો ગોશવારા દર્તા રજિષ્ટરકો નમુના**

ગુનાસો પ્રાપ્ત મિતિ	માધ્યમ	ગુનાસોકર્તાનો વિવરણ						ગુનાસોનો વિવરણ		
		નામ, થર	લિઙ્ગ	ઉંમેર	અપાજીતાકો અવસ્થા (યદિ સ્વઇચ્છાલે ખુલાએમા)	ઠેગાના	ફોન નંબર વા ઈમેલ	ગુનાસોનો વિષય	સંક્ષિપ્ત વિવરણ	ગુનાસો બારે આવેદન કર્તાલાઈ જાનકારી ગરાઇએકો મિતિ

પુનઃચ : ગુનાસોકર્તાને આપનો પરિચય ખોલ્ન ન ચાહેમા નામ ર ઠેગાના અમુક ભની લેખ્નુ પર્દછુ ।

**અનુસૂચી ૨**

વિજયનગર ગાઉંપાલિકા, .....નં. વડા કાર્યાલય .....

**ગુનાસોનો પ્રકૃતિ અનુસારકા વર્ગીકરણકો અભિલેખ ઢાંચા**

ક્ર.સં.	વિષય અનુસારકો ગુનાસોનો વિવરણ	ગુનાસોનો પ્રકૃતિ અનુસારકો વર્ગીકરણ				જમ્મા ગુનાસો સંખ્યા	કૈફિયત
		અતિ સંવેદનશિલ	સંવેદનશિલ	સાધારણ	કારવાહી સમ્વન્ધી		

**અનુસૂચી ૩**

વિજયનગર ગાઉંપાલિકા, .....નં. વડા કાર્યાલય .....

**ગુનાસો પ્રતિવેદન ઢાંચા**

ક્ર.સં.	ગુનાસોનો પ્રકૃતિ વિવરણ (વર્ગીકરણ)	ગુનાસા સંખ્યા			સમ્વોધન ભાએકા ગુનાસા સંખ્યા	સમ્વોધન હુન બાંકિ ગુનાસા			કૈફિયત
		મહિલા	પુરુષ	અપાજીતા (ખુલાએમા)		યહિબાટ હુને	તલ વા માથિ પઠાઉને	સમ્વોધન હુન લાગે અનુમાનિત સમય	

પ્રમાણીકરણ ગર્નેકો

દસ્તખત :

નામ,થર :

દર્જા :

મિતિ :

કાર્યાલયકો છાપ :

ગુનાસો સમ્વોધન દિનાંક  
સર્વોધન પ્રાપ્તિકોને જાહેર

ગુનાસો સમ્વોધન દિનાંક  
સર્વોધન પ્રાપ્તિકોને જાહેર